

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટન સત્તાવાર રીતે માર્ચના મહિનાને અશ્વેત માનસિક આરોગ્ય જાગરૂકતા અને સશક્તિકરણ માસ (Black Mental Health Awareness and Empowerment Month) તરીકે સ્વીકારે છે.

બ્રેમ્પટન, ઓન્ટારિયો (10 માર્ચ 2021) – માર્ચ 3 ના રોજ બ્રેમ્પટન સીટી કાઉન્સિલે સત્તાવાર રીતે જાહેર કર્યું કે માર્ચ મહિનો અશ્વેત માનસિક આરોગ્ય જાગરૂકતા અને સશક્તિકરણ માસ (Black Mental Health Awareness and Empowerment Month) ગણાશે જે અશ્વેત સમાજમાં માનસિક આરોગ્યની વિષમ પરિસ્થિતિના પ્રતિભાવરૂપ છે.

આવા મહત્વપૂર્ણ મહિનાના ભાગરૂપે શહેરની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સશક્તિકરણ અને અશ્વેત વિરોધી જાતિવાદ એકમ અશ્વેત માનસિક આરોગ્ય જાગરૂકતા અને સશક્તિકરણ સામુદાયિક સત્રોની શ્રેણી યોજશે.

જેમને સહભાગી થવામાં રૂચિ હોય ત્રો નીચે આપેલ [ઓનલાઇન સત્રોમાં અહીં](#) નામ નોંધાવી શકશે.

- યુથ મેન્ટલ હેલ્થ ફોરમ: માર્ચ 18, સાંજે 4:30 થી સાંજે 6
- સિનિયર્સ મેન્ટલ હેલ્થ ફોરમ: માર્ચ 18, સાંજે 6:30 થી 7:30
- વિમેન્સ મેન્ટલ હેલ્થ ફોરમ: માર્ચ 25, સાંજે 6 થી 7:30
- મેન્સ મેન્ટલ હેલ્થ ફોરમ: માર્ચ 25, સાંજે 7:30 થી 8:30
- LGBTQ + મેન્ટલ હેલ્થ ફોરમ: માર્ચ 26, સાંજે 6 થી 7
- અશ્વેત વિરોધી જાતિવાદ પ્રશિક્ષણ સત્ર: માર્ચ 31 સવારે 9 થી રાત્રે 12

અશ્વેત વિરોધી જાતિવાદ અને સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સશક્તિકરણ અને એન્ટી બ્લેક જાતિવાદ એકમ વિશેની બ્રેમ્પટનની પહેલો અંગે વધુ જાણવા માટે brampton.ca/antiblackracism.

પીલમાં માનસિક આરોગ્ય સામુદાયિક સંસાધનોની સૂચિ માટે, [અહીં ક્લિક કરો](#).

બ્રેમ્પટનની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સશક્તિકરણ અને અશ્વેત વિરોધી જાતિવાદ એકમ વિષયક

10 જૂન 2020ના રોજ, સીટી કાઉન્સિલે અશ્વેત આફ્રિકન અને કેરિબિયન સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સશક્તિકરણ અને અશ્વેત જાતિવાદ વિરોધી જાતિવાદ યુનિટને મંજૂરી આપી. વરિષ્ઠ સલાહકાર, ગ્વિનેથ ચેપમેનના નેજા હેઠળ યુનિટની જવાબદારી પ્રાણાલીગત અશ્વેત વિરોધી જાતિવાદને બ્રેમ્પટનમાંથી નાબૂદ કરવાની કાર્ય યોજનાનો વિકાસ અને અમલ કરવાની છે. સ્થાનિક સમૂદાયના હિસ્સાધારકોના

માર્ગદર્શન હેઠળ કાર્ય મુખ્યત્વે બ્રેમ્પટનના અશ્વેત સમાજની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિસ્થિતિઓના ઉત્થાન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

સિટી જેમ જેમ અશ્વેત વિરોધી જાતિવાદ યુનિટનો વિકાસ કરશે ત્યારે વધુ જાણકારી મેળવવા માટે અને તેમા સામેલ થવામાં પોતાની રૂચિ દર્શાવવા કૃપા કરી સિટીનો સંપર્ક અહીં કરો economicantiblackracism@brampton.ca.

સુવાક્યો

"આર્થિક સશક્તિકરણ અને કેનેડાના અશ્વેત વિરોધી જાતિવાદ તેમજ અમારા બ્લેક હિસ્ટરી મન્ય ઇવેન્ટ્સને સંબોધિત કરતી બ્રેમ્પટનની પ્રથમ વર્ચુઅલ કોન્ફરન્સની તુરંત બાદ અમને માર્ચ મહિનાને બ્લેક મેન્ટલ હેલ્થ અવેરનેસ એન્ડ એમ્પાવરમેન્ટ મન્ય તરીકે જાહેર કરતા ગૌરવની લાગણી થાય છે અને અશ્વેત સમાજના માનસિક આરોગ્યની ફોરમ યોજી રહ્યા છીએ. અશ્વેત વિરોધી જાતિવાદ અને બ્રેમ્પટનનું અશ્વેત આફ્રિકન અને કેરેબિયન સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સશક્તિકરણ અને એન્ટી બ્લેક જાતિવાદ એકમ બ્રેમ્પટન ખાતે ઊંડા મૂળિયા ધરાવતા અશ્વેત વિરોધી જાતિવાદ નાબૂદ કરવામાં મહત્વપૂર્ણ કામગીરી બજાવી રહી છે."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"અશ્વેત માનસિક આરોગ્ય જાગૃકતા અને સશક્તિકરણ કમ્યુનિટી સત્રો તમામ હિસ્સાધારકોને ભેગા કરશે જેનું લક્ષ્ય અશ્વેત માનસિક આરોગ્ય સમસ્યા ભોગવતા લોકોનું સશક્તિકરણ કરવાનું છે અને પ્રશિક્ષણ તેમજ વધુ સારી મેનેજમેન્ટ પ્રણાલીઓ મારફતે કામકાજના સ્થળો અને સમાજમાં રહેલ જાતિલક્ષી ભેદભાવોનો સામનો કરવાનું છે."

- ડેવિડ બાર્રિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રેમ્પટન

"આવો મહિનો અશ્વેત માનસિક આરોગ્ય અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરતા પ્રામાણિક અને માહિતગાર સંવાદ માટે વધુ મોટી તકો ઊભી કરશે. આપણે તેમાંથી અશ્વેત જાતિવાદની હાનિકારક સામાજિક અને આર્થિક અસરો વિશે જાણી શકીશું જેનાથી આશા છે કે તમામ કેનેડિયનો અને બ્રેમ્પટનવાસીઓ તે ઉકેલના ભાગ બનવાનું પસંદ કરશે. શહેરનું આર્થિક સશક્તિકરણ અને એન્ટી બ્લેક જાતિવાદ એકમ આ મહિનાના આવનાર સત્ર મારફતે રહેવાસીઓને પ્રવૃત્ત કરવા ઉત્સુક છે."

- ગ્વિનેથ ચેપમેન (Gwyneth Chapman), વરિષ્ઠ સલાહકાર, આર્થિક સશક્તિકરણ અને અશ્વેત વિરોધી જાતિવાદ (Economic Empowerment and Anti-Black Racism), સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

ਮਿਡਿਆ ਸੰਪਰਕ :

ਗੁਰਵਿੰਦਰ ਸਿੰਘ (Gurvinder Singh)

ਕੋਆਰਡਿਨੇਟਰ, ਮਿਡਿਆ ਐਂਡ ਕਮਿਊਨਿਟੀ ਐਂਗੇਜਮੇਂਟ

ਵ੍ਹਾਟਸਥ ਸੰਵਾਦ

ਸੀਟੀ ਓਫ਼ ਬਰੈਂਪਟਨ

905-874-2028 | Gurvinder.A.Singh@brampton.ca